

**Ref. No.** DIL/SE/23-24/19

**Date:** May 27, 2024

**To,**  
**The Manager**  
**Corporate Relationship Department**  
**BSE Limited**  
Phiroze Jeejeebhoy Towers,  
Dalal Street,  
Mumbai - 400 001

**The Manager**  
**Listing Department**  
**National Stock Exchange of India Limited**  
Exchange Plaza, Bandra Kurla Complex  
Bandra (East),  
Mumbai - 400 051

**BSE Symbol - DOMS**  
**BSE Scrip Code - 544045**

**NSE Symbol - DOMS**

**Sub.: Intimation of Newspaper advertisement pertaining to Audited Financial Results (Standalone and Consolidated) for the quarter and year ended March 31, 2024**

Dear Sir / Madam,

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended, ('**SEBI LODR Regulations**') we are enclosing copies of newspaper advertisement pertaining to the Audited Financial Results (Standalone and Consolidated) for the quarter and year ended March 31, 2024, which were considered and approved by the Board of Directors at their meeting held on Friday, May 24, 2024.

The advertisements were published on May 26, 2024, in 'Financial Express' (English) and in 'Gujarat Guardian' (Gujarati).

The Newspaper advertisement is also available on website of the Company at [www.domsindia.com](http://www.domsindia.com).

The above is for your kind information and record.

Thanking you,  
Yours faithfully,

**For DOMS Industries Limited**

Mitesh  
Ashok Padia

Digitally signed by  
Mitesh Ashok Padia  
Date: 2024.05.27  
14:56:38 +05'30'

**Mitesh Padia**  
**Company Secretary and Compliance Officer**  
**Membership No.: A58693**

**Registered Office:**

J-19, Opp. Telephone Exchange,  
G.I.D.C., Umbergaon- 396171,  
Dist. Valsad, Gujarat, India.

**Website:**

[www.domsindia.com](http://www.domsindia.com)

**Corporate Office:**

Plot No. 117, G.I.D.C., 52, Hector Expansion  
Area, Umbergaon- 396171,  
Dist. Valsad, Gujarat, India.

**Tel:** (+91) 7434888445 / 446

**E-mail:** [info@domsindia.com](mailto:info@domsindia.com)

**Mumbai Office:**

17th Floor, C-Wing, Kailas Business Park,  
Hiranandani Link Road, Vikhroli (W)  
Mumbai- 400079, Maharashtra, India.

**Tel:** (+91) 7069028500 / 600

**Email:** [asst.admin@domsindia.com](mailto:asst.admin@domsindia.com)

**LCCINFOTECH LIMITED**  
(CIN: L72209WB18850179196)  
REG. OFFICE: P-16, C-1, ROAD 'S' ENLARGED KOLKATA WZ 70014  
EMAIL: CORPORATE@LCCINFOTECH.CO.IN, URL: WWW.LCCINFOTECH.CO.IN  
PH. NO. 033-5546193

Extract of Audited Standalone & Consolidated Financial Results for the QoY and Year ended on 31.03.2024

(Rs. in Lakhs except EPS)

Sr. No.	Particulars	Quarter Ended		Year ended		Quarter Ended		Year ended	
		31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2022	31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2022
1	Total Income from Operations	15,501	15,596	118,591	28,812	177,152	115,859	28,812	117,112
2	Net Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items)	(6,036)	4,491	49,481	(6,426)	(9,327)	4,491	49,481	(6,426)
3	Net Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items) (after tax)	(5,322.22)	4.89	49,331	(6,342.46)	(8,572.44)	4.89	49,121	(6,332.66)
4	Net Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items) (after tax) (after Extraordinary and/or Extraordinary items)	(5,322.22)	4.89	49,331	(6,342.46)	(8,572.44)	4.89	49,121	(6,332.66)
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(5,322.22)	4.89	49,331	(6,342.46)	(8,572.44)	4.89	49,121	(6,332.66)
6	Paid Up Equity Share Capital (Rs. 10/- each)	2,531.87	2,531.87	2,531.87	2,531.87	2,531.87	2,531.87	2,531.87	2,531.87
7	Reserves (including Reserves as shown in Audited Balance Sheet of the previous year)	-	-	(2,248.87)	3,084.47	-	-	(2,248.15)	3,047.51
8	Earnings Per Share (EPS): a) Basic b) Diluted	(282.81) (282.81)	0.009 0.009	0.190 0.190	(4.212) (4.212)	(0.950) (0.950)	0.008 0.008	0.190 0.190	(4.214) (4.214)

Notes: The above is an extract of the detailed format of Audited Standalone Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015. The full format of the above financial results are available on the website of the Stock Exchanges and Company's website [www.lccinfotech.com](http://www.lccinfotech.com). The Audited Financial Results were reviewed by the Audit Committee and by the Board of Directors at their Meeting held on May 24, 2024.

Place: Kolkata  
Date: 22nd May 2024

For and on behalf of the Board of Directors:  
Kriti Lashari  
Managing Director, (DIN: 03097257)

**ORAVEL STAYS LIMITED**  
Registered office: Ground Floor-001, Marunah Elana, Shyamli Cross Road, Near Park Hotel, Salimabad, Ahmedabad - 380015, India  
Corporate office: 4<sup>th</sup> Floor, Space Plaza, Sector 69, Gurugram, Haryana 122001 India  
CIN: U68900GJ2012PL10788 | Phone: 874-4109282 & 9124-4487253  
Email: [investor@oravelstays.com](mailto:investor@oravelstays.com) | [www.oravelstays.com](http://www.oravelstays.com)

**NOTICE**  
**NOTICE OF 2<sup>nd</sup> EXTRAORDINARY GENERAL MEETING FOR FINANCIAL YEAR 2023-24 AND INVITING INFORMATION**

Notice is hereby given that 2<sup>nd</sup> Extraordinary General Meeting (EGM) of the members of Oravel Stays Limited (the Company) for financial year 2023-24 will be held on **Tuesday, June 18, 2024 at 8:30 P.M. (IST)** through Video Conferencing/other audio visual means (VVC/OAVM), in compliance with all applicable provisions of the Companies Act, 2013 (the Act) read with applicable circulars issued by the Ministry of Corporate Affairs (MCA), from time to time, to transact the businesses as set out in the EGM Notice.

The notice of the EGM of the Company has been sent only by email/electronic form to all the members whose names appear in the Register of members on **Friday, May 17, 2024** and e-mail addresses are registered with the Company/RTA/Depository Participants. The requirement of sending physical copies of the Notice of the EGM is dispensed with by MCA circulars. The documents are also available on the website of the Company at <https://www.oravelstays.com/investor-relations> and the website of M/s. Link Intime India Pvt. Ltd. i.e. <https://linkintimeindia.com>.

The Company is providing the facility of remote voting (electronic voting system from a place other than EGM venue) before the EGM voting during the EGM will commence from **Friday, June 14, 2024 at 9:00 A.M. (IST)** and ends on **Monday, June 17, 2024 at 5:00 P.M. (IST)**. The remote voting module will be disabled thereafter by Voting Agency.

The notice of EGM is being disseminated through the following means:  
a. The special business as set out in the notice of EGM will be transacted through voting by electronic means.  
b. The remote voting will commence from Friday, June 14, 2024 at 9:00 A.M. (IST) and ends on Monday, June 17, 2024 at 5:00 P.M. (IST).  
c. The remote voting module will be disabled thereafter by Voting Agency.  
d. The Cut-off Date for determining the eligibility of the members who are eligible to vote by electronic means is **Tuesday, June 11, 2024 (Cut-off date)**.

The voting facility shall also be made available during the EGM and the Members attending the Meeting, who have not already cast their vote by remote voting shall be able to exercise their right during the Meeting. A person whose name is recorded in the Register of Members as on the Cut-off date shall be entitled to avail the facility of remote voting (before the EGM) or voting during the EGM.

Any person who acquires shares in respect of the business to be transacted at the EGM and holds such shares as on the Cut-off date, may obtain the login-id and password for voting by sending a request to [rtat@oravelstays.com](mailto:rtat@oravelstays.com). A person who is not a Member as on the Cut-off date shall not be entitled to avail the facility of remote voting.

Members who have cast their vote by remote voting prior to the meeting may also attend the meeting electronically, but shall not be entitled to vote again at the EGM.

The login credentials for remote voting may also be used for attending the EGM through VCOAVM. Members who have not registered their e-mail addresses are requested to update the same with their Depository Participant (for shares held in dematerialized form) or with M/s. Link Intime India Pvt. Ltd. (RTA) (for shares held in physical form).

For any queries (previously registered remote voting), members may write an email to the undersigned at [investor@oravelstays.com](mailto:investor@oravelstays.com) or may call on +91-2414916000 (Ext: 2505) or send a request to M. Rajy Ranjan, Assistant Vice President - e-voting (Link Intime) at [investor@linkintime.com](mailto:investor@linkintime.com) or on +91-11-26711101, 1st Floor, 247 Park, L.B.S. Marg, Vileparle (West), Mumbai 400083, Maharashtra, India. The members are requested to carefully read all the instructions set out in the notice of EGM and in particular, instructions for voting EGM through VCOAVM and manner of casting vote through e-voting.

For Oravel Stays Limited  
Shivam Kumar  
Company Secretary & Compliance Officer

Place: Gurugram  
Date: May 25, 2024

**HARMONY CAPITAL SERVICES LTD.**  
CIN: L17209WB18850179196  
REG. OFFICE: No. 405, 4th Floor, A Wing, 113 Park Street, Kolkata 700016, India  
Corporate Office: Plot No. 10B, Sector 10, Phase 1, Salt Lake City, Kolkata 700061, India  
Email: [investor@hcs.com](mailto:investor@hcs.com) | [www.hcs.com](http://www.hcs.com)

Extract of Standalone and Consolidated Financial Results for the Quarter and Year ended 31<sup>st</sup> March 2024 (Amount in Rs. Lakhs) Except EPS

Sr. No.	Particulars	Quarter ended		Year ended	
		31.03.2024	31.03.2023	31.03.2024	31.03.2023
1	Total Income from Operations	(Audited)	(Audited)	(Audited)	(Audited)
2	Net Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items)	(2.78)	12.67	(9.21)	15.14
3	Net Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items) (after tax)	(2.78)	12.67	(9.21)	15.14
4	Net Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items) (after tax) (after Extraordinary and/or Extraordinary items)	(0.30)	12.67	(6.73)	15.14
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(0.30)	12.67	(6.73)	15.14
6	Equity Share Capital (Face Value of Rs.10/- each)	300.09	300.09	300.09	300.09
7	Reserves (including Reserves as shown in the Balance Sheet of the previous year)	-	-	-	-
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations): a) Basic b) Diluted	(0.01)	0.42	(0.22)	0.51

Notes:  
1. The above is an extract of the detailed format of audited consolidated financial results filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015. The full format of the audited consolidated financial results is available on the Stock Exchange website ([www.bseindia.com](http://www.bseindia.com)) and the company's website ([www.hcs.com](http://www.hcs.com)).  
2. The impact on net profit/loss, total comprehensive income or any other relevant financial metrics due to changes in accounting policies applied in accordance with Indian Accounting Standards (Ind AS) prescribed under section 133 of the Companies Act, 2013 (the Act) is not applicable. However, in terms of Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, the company has provided the details of the changes in accounting policies in its Annual Report for the year ended March 31, 2024.  
3. The above results have been reviewed and recommended by the Board of Directors of the Audit Committee and subsequently approved by the Board of Directors at its meeting held on May 24, 2024. These results have been audited by statutory auditors who have issued an unqualified opinion.

For HCS Limited  
Harmony Capital Services Limited  
Place: Mumbai  
Date: 24.05.2024  
Jatin Parikh  
Managing Director & CFO

**Modern Engineering and Projects Limited**  
(Formerly known as Modern Concretes Limited)  
CIN: L01120MH18850179196  
103/4 Plot -215, Free Press House, Fl-10, Free Press Journal Marg, Nariman Point, Mumbai - 400021.  
Email: [cs@mpel.in](mailto:cs@mpel.in); Website: [www.mpel.in](http://www.mpel.in); Telephone No: 022-66666007

**STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2024**

(In ₹ Lakhs (Except earnings per share data))

Sr. No.	Particulars	Quarter Ended		Year Ended		Year Ended	
		March 31, 2024	December 31, 2023	March 31, 2023	March 31, 2024	March 31, 2023	March 31, 2022
1	Total Income	4,074.15	1,985.87	6,761.81	9,324.93	6,779.89	15,455.45
2	Net Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items)	4,074.15	1,985.87	6,775.06	9,384.38	6,943.34	15,455.45
3	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	4,074.15	1,985.87	6,775.06	9,384.38	6,943.34	15,455.45
4	Paid Up Equity Share Capital (Face Value of ₹10 per share)	309.00	309.00	309.00	309.00	309.00	309.00
5	Reserves (including Reserves as shown in Audited Balance Sheet of the previous year)	-	-	-	-	-	-
6	Earnings Per Share (EPS): a) Basic b) Diluted	5.25	0.04	(2.84)	11.77	(8.57)	50.00

Notes: The above is an extract of the detailed format of Audited Standalone Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015. The full format of the above financial results are available on the website of the Stock Exchanges and Company's website [www.mpel.in](http://www.mpel.in). The Audited Financial Results were reviewed by the Audit Committee and by the Board of Directors at their Meeting held on May 24, 2024.

Place: Mumbai  
Date: May 24, 2024

For and on behalf of the Board of Directors:  
Sitarom Dholakia  
Managing Director, (DIN: 0340899)

**DOMS INDUSTRIES LIMITED**  
(formerly known as DOMS Industries Private Limited)  
CIN: U68900GJ2012PL10788 | Phone: 874-4109282 & 9124-4487253  
Email: [investor@doms.com](mailto:investor@doms.com) | [www.domsindia.com](http://www.domsindia.com)

Extract of the Consolidated Financial Results for the quarter and year ended March 31, 2024

(In ₹ Lakhs, except per equity share data)

Sr. No.	Particulars	Quarter ended		Quarter ended	
		March 31, 2024	March 31, 2023	March 31, 2024	March 31, 2023
1	Total income from operations	40,373.86	15,714.16	33,947.72	33,947.72
2	Net Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items)	6,295.54	21,448.23	4,913.85	4,913.85
3	Net Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items) (after tax)	6,295.54	21,448.23	4,913.85	4,913.85
4	Net Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items) (after tax) (after Extraordinary and/or Extraordinary items)	4,693.35	15,896.15	3,621.12	3,621.12
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	4,693.35	15,896.15	3,621.12	3,621.12
6	Equity Share Capital (Face value of ₹10 per share)	6,068.72	6,068.72	37.25	37.25
7	Other Equity	-	-	72,705.45	-
8	Earnings per equity share (not audited): (Face value: ₹10/- each) a) Basic b) Diluted	76.16 76.16	27.75 27.75	64.44 64.44	64.44 64.44

Notes:  
1. The above is an extract of the detailed format of audited consolidated financial results for the quarter and year ended March 31, 2024 filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015. The full format of the audited consolidated financial results for the quarter and year ended March 31, 2024 are available on the website of the Stock Exchanges at [www.bseindia.com](http://www.bseindia.com) and also on the Company's website [www.domsindia.com](http://www.domsindia.com).  
2. The above audited financial results have been reviewed and approved by the Audit Committee at its meeting held on May 24, 2024. The Board of Directors at its meeting held on May 24, 2024 have approved the above results and taken them on record.

For and on behalf of the Board of Directors of DOMS Industries Limited (formerly known as DOMS Industries Private Limited):  
Sd/-  
Santosh Ravishankar  
Managing Director  
DIN: 00419294

Date: May 24, 2024  
Place: UMBERGANG

**TITAGARH RAIL SYSTEMS LIMITED**  
(formerly TITAGARH SYSTEMS LIMITED)  
CIN: L72209WB18850179196  
Registered Office: Plot No. 10B, Sector 10, Phase 1, Salt Lake City, Kolkata 700061, India  
Corporate Office: Titagarh Towers, 756 Anandapur, E.M. Bypass, Kolkata 700107, India  
Tel: 93 30190800. Email: [investors@titagarh.com](mailto:investors@titagarh.com); Website: [www.titagarh.com](http://www.titagarh.com)

**NOTICE**  
[For Transfer of shares to the demat account of Equity Debit and Protection Fund (EPF) Authority as per Section 124(b) of the Companies Act, 2013 (the Act)]

In terms of Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, the key facts of Standalone Financial Results for the quarter and year ended March 31, 2024 are as follows:

(In ₹ Lakhs, except per equity share data)

Sr. No.	Particulars	Quarter ended		Quarter ended	
		March 31, 2024	March 31, 2023	March 31, 2024	March 31, 2023
1	Income from operations (Turnover)	36,240.81	13,871.79	29,664.81	29,664.81
2	Profit before tax	7,725.50	19,471.04	4,289.22	4,289.22
3	Profit after tax	4,279.03	14,509.88	3,170.67	3,170.67
4	Total Comprehensive Income for the period (after tax)	4,289.30	14,366.32	3,165.07	3,165.07

Notes:  
1. The above is an extract of the detailed format of audited consolidated financial results for the quarter and year ended March 31, 2024 filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015. The full format of the audited consolidated financial results for the quarter and year ended March 31, 2024 are available on the website of the Stock Exchanges at [www.bseindia.com](http://www.bseindia.com) and also on the Company's website [www.titagarh.com](http://www.titagarh.com).  
2. The above audited financial results have been reviewed and approved by the Audit Committee at its meeting held on May 24, 2024. The Board of Directors at its meeting held on May 24, 2024 have approved the above results and taken them on record.

For and on behalf of the Board of Directors of Titagarh Rail Systems Limited (formerly known as Titagarh Systems Limited):  
Sd/-  
Dinesh Arya  
Managing Director  
Company Secretary & Chief Compliance Officer

Place: Kolkata  
Date: 25th May, 2024

**MEHTA HOUSING FINANCE LIMITED**  
Regd. Off: Plot No. 1A, Revenue Survey No. 203, Savitribai Road, Tandi, Mahabubnagar, Gujarat - 384290  
CIN: L15100GJ2009990029999  
Email: [mehta@mehta.com](mailto:mehta@mehta.com); Website: [www.mehta.com](http://www.mehta.com)

Extract of Standalone Financial Results for the Quarter and Financial Year ended March 31, 2024

(Rs. in Lakhs)

Sr. No.	Particulars	For quarter ended		Year ended	
		31.03.2024	31.12.2023	31.03.2023	31.03.2022
1	Total Income from Operations (net)	0.00	0.00	0.00	0.00
2	Net Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items)	(5.88)	(4.46)	(4.62)	(20.30)
3	Net Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items) (after tax)	(5.88)	(4.46)	(4.62)	(20.30)
4	Net Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items) (after tax) (after Extraordinary and/or Extraordinary items)	(5.88)	(4.46)	(4.62)	(20.30)
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(5.88)	(4.46)	(4.62)	(20.30)
6	Paid Up Equity Share Capital (Rs. 10/- each)	308.20	308.20	308.20	308.20
7	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations): a) Basic b) Diluted	(0.19)	(0.14)	(0.15)	(0.66)

Notes:  
1. The above is an extract of the detailed format of Audited Standalone Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015. The full format of the audited financial results are available on the website of the Stock Exchanges and Company's website [www.mehta.com](http://www.mehta.com). The Audited Financial Results were reviewed by the Audit Committee and by the Board of Directors at their Meeting held on May 24, 2024.  
2. Previous years figures have been regrouped/rearranged wherever necessary to make them comparable.

Extract of Consolidated Financial Results for the Financial Year ended March 31, 2024

(Rs. in Lakhs)

Sr. No.	Particulars	Year ended	
		31.03.2024	31.03.2023
1	Total Income from Operations (net)	0.00	0.00
2	Net Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items)	(20.30)	(19.43)
3	Net Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items) (after tax)	(20.30)	(19.43)
4	Net Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items) (after tax) (after Extraordinary and/or Extraordinary items)	(20.30)	(19.43)
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(20.30)	(19.43)
6	Paid Up Equity Share Capital (Rs. 10/- each)	308.20	308.20
7	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations): a) Basic b) Diluted	(0.66)	(0.63)

Notes:  
1. The above is an extract of the detailed format of Audited Consolidated Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015. The full format of the audited financial results are available on the website of the Stock Exchanges and Company's website [www.mehta.com](http://www.mehta.com). The Audited Financial Results were reviewed by the Audit Committee and by the Board of Directors at their Meeting held on May 24, 2024.  
2. This being the first year of Annual consolidation, the figures of previous annual period for comparative are reported.  
3. Previous years figures have been regrouped/rearranged wherever necessary to make them comparable.

For Mehta Housing Finance Limited  
Sd/-  
Vishal Rajput  
Chairman & Managing Director  
DIN: 0907717

Date: 24.05.2024  
Place: Mahuva

**A. K. CAPITAL SERVICES LIMITED**  
BUILDING BONDS  
Registered Office: 603, 6th Floor, Windsor, Off CST Road, Kalina, Santacruz (East), Mumbai - 400 009  
Phone: 912022 6754 6000 | Fax: 912022 6610 0594 | Email: [compliance@akgroup.in](mailto:compliance@akgroup.in) | Website: [www.akgroup.in](http://www.akgroup.in) | CIN: U68999MH1993PLC274881

Extract of Audited Standalone and Consolidated Results for the Quarter and Year ended March 31, 2024 (In Lakhs except per share data)

Sr. No.	Particulars	Standalone Quarter ended		Standalone Year ended		Consolidated Quarter ended		Consolidated Year ended	
		31.03.2024	31.03.2023	31.03.2024	31.03.2023	31.03.2024	31.03.2023	31.03.2024	31.03.2023
1	Total Income from Operations	3,885.04	3,155.20	2,895.04	12,719.25	14,684.04	13,199.55	11,654.00	42,689.69
2	Net Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items)	1,213.57	979.24	945.69	4,032.16	4,032.16	2,600.20	3,126.40	11,782.59
3	Net Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items) (after tax)	1,213.57	979.24	945.69	4,032.16	4,032.16	2,600.20	3,126.40	11,782.59
4	Net Profit/(Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items) (after tax) (after Extraordinary and/or Extraordinary items)	886.51	3,096.24	3,096.24	2,000.20	2,477.61	9,250.19	6,814.58	18,238.19
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	886.51	3,096.24	3,096.24	2,000.20	2,477.61	9,250.19	6,814.58	18,238.19
6	Equity Share Capital	600.00	600.00	600.00	600.00	600.00	600.00	600.00	600.00
7	Reserves (including Reserves as shown in the Balance Sheet of previous year)	-	-	-	-	-	-	-	-
8	Basic (₹10/- not annualised) Diluted (₹10/- not annualised)	13.50 13.50	12.06 12.06	12.00 12.00	48.16 48.16	45.38 45.38	39.02 37.19	138.95 138.95	132.78 132.78
9	Earnings Per Share (after extraordinary items) (of ₹10/- each) Basic (₹10/- not annualised) Diluted (₹10/- not annualised)	13.50 13.50	12.06 12.06	12.00 12.00	48.16 48.16	45.38 45.38	39.02 37.19		

# ભારત શાંઘહાઈ કાર્પોરેશનની બેઠકમાં આતંકવાદ માટે ભવણ ધોરણન વખાડ્યા

આતંકવાદ માટે ભવણ ધોરણન વખાડ્યા

આતંકવાદ માટે ભવણ ધોરણન વખાડ્યા

આતંકવાદ માટે ભવણ ધોરણન વખાડ્યા

## આતંકવાદ પર ભવણનું પુનરાવર્તન કરતા સમૂહ અને વિકાસ માટે આતંકવાદ શૂન્ય સરિષ્ટ્યુતાની માગ કરી

આતંકવાદ પર ભવણનું પુનરાવર્તન કરતા સમૂહ અને વિકાસ માટે આતંકવાદ શૂન્ય સરિષ્ટ્યુતાની માગ કરી

# હાર્દિક પંડ્યાના છટકા પછી નતાશા સ્ટેનકોવિકની પોસ્ટથી ભવાં ચડ્યાં

નતાશા સ્ટેનકોવિકની પોસ્ટથી ભવાં ચડ્યાં

નતાશા સ્ટેનકોવિકની પોસ્ટથી ભવાં ચડ્યાં

આતંકવાદ પર ભવણનું પુનરાવર્તન કરતા સમૂહ અને વિકાસ માટે આતંકવાદ શૂન્ય સરિષ્ટ્યુતાની માગ કરી

આતંકવાદ પર ભવણનું પુનરાવર્તન કરતા સમૂહ અને વિકાસ માટે આતંકવાદ શૂન્ય સરિષ્ટ્યુતાની માગ કરી

હાર્દિક પંડ્યાના છટકા પછી નતાશા સ્ટેનકોવિકની પોસ્ટથી ભવાં ચડ્યાં

### OSBI સાર-સેવકોની સમાજ સેવાઓ

સાર-સેવકોની સમાજ સેવાઓ

### પરિષદ સેવાઓ

પરિષદ સેવાઓ

હાર્દિક પંડ્યાના છટકા પછી નતાશા સ્ટેનકોવિકની પોસ્ટથી ભવાં ચડ્યાં

### DOMS Industries Limited

DOMS Industries Limited

Sr.	Particulars	Year ended March 31, 2024		
		Quarter ended March 31, 2024	Year ended March 31, 2024	Quarter ended March 31, 2023
1	Total Income from operations	40,273.86	153,174.18	33,647.72
2	Net Profit / (Loss) for the period (Before Tax, Exceptional and Extraordinary Items)	6,295.54	21,448.23	4,913.85
3	Net Profit / (Loss) for the period before tax (after Extraordinary and Extraordinary Items)	6,295.54	21,448.23	4,913.85
4	Net Profit / (Loss) for the period after tax (after Extraordinary and Extraordinary Items)	4,693.31	15,966.15	3,621.12
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period after tax and Other Comprehensive Income (after tax))	4,693.31	15,912.78	3,619.62
6	Per Share Earnings Share Capital (Face value of ₹10 per share)	6,068.72	6,068.72	37.25
7	Other Equity	-	-	-
8	Per Share Earnings (not annualized)	-	-	-
-	- Basic (in ₹)	9.16	27.75	9.64
-	- Diluted (in ₹)	9.16	27.75	9.64

Sr.	Particulars	Year ended March 31, 2024		
		Quarter ended March 31, 2024	Year ended March 31, 2024	Quarter ended March 31, 2023
1	Income from operations (Turnover)	36,240.81	138,711.79	29,624.61
2	Profit before tax	5,725.50	19,471.04	4,289.22
3	Profit after tax	4,279.03	14,566.86	3,170.67
4	Total Comprehensive Income for the period after tax	4,280.30	14,566.86	3,165.07

### શ્રી કૃષ્ણ મુરારી

શ્રી કૃષ્ણ મુરારી

### Bank of Baroda

Bank of Baroda

### કન્યા નીડસ (સ્વાયત્ત મિલકત માટે)

કન્યા નીડસ (સ્વાયત્ત મિલકત માટે)

### મિલકત ભાડે

મિલકત ભાડે

### કન્યા નીડસ (સ્વાયત્ત મિલકત માટે)

કન્યા નીડસ (સ્વાયત્ત મિલકત માટે)

### કન્યા નીડસ (સ્વાયત્ત મિલકત માટે)

કન્યા નીડસ (સ્વાયત્ત મિલકત માટે)

### મિલકત ભાડે

મિલકત ભાડે